

B.Com. Semester - 6 (CBCS) Examination
March/April-2023 (NEW COURSE)
Indirect Tax Law-2 (Dse-3 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ નોંધણી એટલે શું? ફરજિયાત નોંધણી માટેની પ્રક્રિયાની ચર્ચા કરો. [20]
 અથવા
 પ્રશ્ન.૧ નોંધણી એટલે શું? નોંધણી રદ કરવા માટેની પ્રક્રિયાની ચર્ચા કરો.
 પ્રશ્ન.૨ રસીદ અને ચુકવણી વાઉચર વિશે વિગતવાર ચર્ચા કરો. [20]
 અથવા
 પ્રશ્ન.૨ ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવા અંગે યોગ્યતા અને શરત વિશે વિગતવાર સમજાવો.
 પ્રશ્ન.૩ ભારતના પ્રાદેશિક મતદાતા વિશે સવિસ્તર જણાવો [15]
 અથવા
 પ્રશ્ન.૩ કસ્ટમ લો એટલે શું? તે અંગેના બંધારણીય જોગવાઈ જણાવો
 પ્રશ્ન.૪ માલ અને સેવા ઉપરનો કરના ફાયદાઓની ચર્ચા કરો. [15]
 અથવા
 પ્રશ્ન.૪ વધારાની કસ્ટમ ડ્યુટી અને એન્ટી ડમ્પિંગ ડ્યુટીની વિગતવાર ચર્ચા કરો.

ENGLISH VERSION

- Q-1 What is Registration? Discuss procedure of compulsory registration. [20]
 OR
 Q-1 What is Registration? Discuss procedure of cancellation of registration.
 Q-2 Discuss in detail about Receipt and Payment Voucher [20]
 OR
 Q-2 Explain in detail about Eligibility and condition for taking I.T.C.
 Q-3 Explain in detail about territorial waters in India [15]
 OR
 Q-3 What is custom law? Explain its Constitutional provisions.
 Q-4 Discuss about the benefits of Goods and service tax [15]
 OR
 Q-4 Discuss Additional custom duty and Anti – Dumping duty in detail
